

12 એપ્રિલ 2018

પ્રોવિન્સ દ્વારા બ્રમ્પ્ટન કમ્યુનિટી ઈમર્જન્સી રિસ્પોન્સનાં છ વોલન્ટ્યર્સનું બહુમાન

બ્રમ્પ્ટન, ON – એપ્રિલ, 11ને બુધવારના દિને બ્રમ્પ્ટન ખાતે થયેલ એક પ્રસંગમાં છ બ્રમ્પ્ટનનાં નિવાસીઓનું 2018 ઓન્ટારિયો વોલન્ટ્યર સર્વિસ પુરસ્કારથી બહુમાન કરવામાં આવ્યું. નામદાર હરિંદર માલહી, સ્ટેટસ ઓફ વિમેનના મંત્રી દ્વારા પ્રોવિન્સ વતી પુરસ્કારો આપવામાં આવ્યા.

રાલ્ફ ડેનિ, લિન્ડા ડુગુએ, કિશન દત્ત, લુઈઝ ગોમેઝ, બ્રાયન ગોવર અને બ્રુસ લિલિનું બહુમાન તેઓની વર્ષો સુધી સ્વયંસેવક તરીકેની સેવા જે મોટા ભાગના લોકોએ 15 વર્ષ સુધી કરી તે માટે કરવામાં આવ્યું. તેઓ તમામને તે સેવા કરવાની તક બ્રમ્પ્ટનના કમ્યુનિટી ઈમર્જન્સી રિસ્પોન્સ વોલન્ટ્યર્સ (CERV) મારફત સાંપડી જે એવો કાર્યક્રમ છે જેની સ્થાપના બ્રમ્પ્ટન ઈમર્જન્સી મેનેજમેન્ટ ઓફિસ દ્વારા બ્રમ્પ્ટનમાં થતાં વિવિધ પ્રસંગો તેમજ ગંભીર કમ્યુનિટી ઈમર્જન્સી દરમિયાન મદદ પૂરી પાડવા માટે થઈ.

બ્રમ્પ્ટનના મેયર લિન્ડા જેકીએ કહ્યું, “ આ સ્વયંસેવકોનો તેઓની બ્રમ્પ્ટનને વર્ષો સુધી આપેલ સેવા માટે અને આ સર્વોત્તમ ઈમર્જન્સી રિસ્પોન્સ સપોર્ટ પ્રોગ્રામ પ્રતિ આભાર વ્યક્ત કરું છું”. “મને એમનો ગર્વ છે અને આત્મવિશ્વાસથી કહી શકું છું કે તેઓ એવા સમુદાયને પ્રતિબિંબિત કરે છે જ્યાં નિવાસીઓ પોતાના પાડોશીઓને મદદની જરૂર હોય ત્યારે હાથ આગળ ધરે છે.”

ઈમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ ઈમર્જન્સી પ્રિપેરેડનેસ કમ્યુનિટી પ્રોગ્રામ્સમાં અગ્રસર રહેવાના બ્રમ્પ્ટનના લક્ષ્યને ધ્યાનમાં લઈને CERV પ્રોગ્રામની સ્થાપના 2003માં થઈ. સીટી મફત તાલીમ આપે છે અને તે પૂર્ણ થયા બાદ શહેરમાં જ્યારે કોઈ કટોકટીની ઘટના બને ત્યારે ઈમર્જન્સી રિસ્પોન્ડરોને સહાય કરવા માટે CERV પ્રોગ્રામના સહભાગીઓને તેમજ બ્રમ્પ્ટન ઈમર્જન્સી મેનેજમેન્ટ ટીમને વ્યક્તિગત અને પારિવારિક સજ્જતા વિષે જાહેર કેળવણી આપવા માટે તૈયાર કરવામાં આવે છે.

CERV પ્રોગ્રામ અન્ય લોકોને મદદરૂપ થવાના કિશન દત્તના થનગનાટ સાથે મેળ ખાતો હતો, “CERV ના ભાગ રહેવાનું સૌથી સંતોષકારક પાસું એટલે એવા સુસ્થાપિત સંગઠન જોડે કાર્ય કરવું જે વ્યક્તિગત અને જાહેર સુરક્ષા માટે કાર્ય કરતું હોય.”

કેટલીક વખત લોકો સ્વયંભૂ રીતે કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે બીજા લોકો ભયજનક સ્થિતિમાં હોય અથવા ઈજાગ્રસ્ત હોય ત્યારે બીજી તરફ જોવાને બદલે મદદ કરવાનું નક્કી કરે છે. ભયજનક ક્ષેત્રોમાં જવાથી આ લોકોને જોખમનો સામનો થઈ શકે છે અને તેઓ પોતે પણ એનો ભોગ બની શકે છે, જેને કારણે ઈમર્જન્સી રિસ્પોન્ડરો પર વધારાનું દબાણ આવી શકે છે. CERV તાલીમની રચના તે કાર્યને ઘટાડવા માટે અને સ્વયંસેવકો કટોકટીમાં સહાયતા આપી શકે તે માટે અને તેઓને ઈમર્જન્સી રિસ્પોન્સ ઓર્ગનાઈઝેશનોના દરેક પાસા અને તેની પ્રક્રિયાઓથી પરિચિત કરવા માટે થઈ છે.

"જીવનનું એક મહાન સત્ય તે છે કે અન્ય લોકોને મદદરૂપ થવામાં અન્યંત સંતોષની લાગણી થાય છે" એમ 15 વર્ષથી સ્વયંસેવક રહેલા બ્રુસ લિલિએ જણાવ્યું. "સીટીના વિવિધ પ્રસંગોમાં સહભાગી થવાથી મેળવ્યું પણ ઘણું અને આનંદ પણ માણ્યો. જોકે, એવી કેટલીક કટોકટીઓ થઈ હતી જેમાં CERVને સહાય માટે બોલાવવા પડ્યા હતાં, જ્યાં સીટીના વિવિધ પ્રસંગોમાં મદદરૂપ થવાથી સામાન્ય જનતાને સીટીની ઈમર્જન્સી મેનેજમેન્ટ ઓફિસ અને CERV શું કરી રહ્યા છે તે વિશે માહિતી અને કટોકટીઓ માટે સજ્જ રહેવા વિષયક મૂળભૂત માહિતી પૂરી પાડવાની તક મળી."

બ્રુસે જણાવ્યું કે "બ્રમ્પટન એવી કોઈ પણ કટોકટી માટે સુસજ્જ છે જેનો આપણે સમનો કરવો પડે અને ઘણું કરીને તો દેશનું સૌથી સુસજ્જ શહેર છે".

મે 6-12 આખા કેનેડામાં ઈમર્જન્સી પ્રિપેરેડનેસ વીક છે અને શહેર ફરતે બ્રમ્પટનની ઈમર્જન્સી મેનેજમેન્ટ ઓફિસ સહભાગી થઈ રહી છે, પ્રસંગોની અને માહિતી સત્રોની યજમાન બની રહી છે. વધુ માહિતી માટે www.brampton.ca/prepared જુઓ.

-30-

બ્રમ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જીવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે ગુંજ ઊઠતા શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે ધૂજતા નથી અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ વધારીએ છીએ. આપણે બ્રમ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જીવસામય શહેર બનાવે. અમને [Twitter](https://twitter.com/cityofbrampton) અને [Facebook](https://facebook.com/cityofbrampton) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રમ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca